

૮.૧૧ પરચક્ખાણ એટલે ?

પ્રત્યાખ્યાન એટલે કે પરચક્ખાણ શબ્દનો અર્થ ત્યાગ કરવું અને પાળવું એમ બે પ્રકારે થાય છે.

આ પરચક્ખાણ મૂળ ગુણરૂપ અને ઉત્તર ગુણરૂપ એમ બે પ્રકારે હોય છે.

મૂળ ગુણરૂપ પરચક્ખાણ ના બે ભેદ છે. ૧. દેશથી ૨. સર્વથી તેમાં સર્વથી મૂળગુણરૂપ પરચક્ખાણ પંચ મહિનત રૂપ તે સાધુ ભગવંતો હોય છે. અને દેશથી ભૂળગુણરૂપ પરચક્ખાણ પંચ અણુવત રૂપ તે શ્રાવકને હોય છે.

સર્વથી ઉત્તરગુણરૂપ પરચક્ખાણ અનાગત આદિ દશ પ્રકારે હોય છે.

૧. **અનાગત પરચક્ખાણ :** પર્યુષણ વગેરે પર્વમાં ગૃહ, ગલાન, તપસ્વી વગેરેનું વૈયાવર્ય કરવાના કારણે અગાઉથી અછુમ વિગેરે તપ કરે તે.
૨. **અતિકાન્ત :** પર્યુષણ વગેરે પર્વમાં વૈયાવર્ય વગેરેના કારણે તપ ન થયો હોય તો પછીથી કરે તે.
૩. **કોટિ સહિત :** ચોવિહાર ઉપવાસ વિગેરે તપ કર્યું હોય તે પૂર્ણ થતાં તરત જ તેવું જ પરચક્ખાણ ફરીથી કરે તે.
૪. **નિયંત્રિત :** કોઈ પણ સંજોગોમાં અમુક દિવસે, અમુક તપ કરીશ-અથે અગાઉથી નિયમ લઈ ધારેલ દિવસે તે તપ કરે જ. (હાલ વિચછેદ થયું છે)
૫. **અનાગાર :** આગાર (છૂટ) રાખ્યા વિના પરચક્ખાણ કરે તે.
૬. **આગાર :** આગાર (છૂટ) રાખીને પરચક્ખાણ કરે તે.
૭. **નિરવશેષ :** ચાર પ્રકારના આહાર તથા અણાહાર વસ્તુનું પરચક્ખાણ કરે તે.
૮. **પરિમાણકૃત :** દંતિ, કવળ (કોળીયો) કે ઘરની સંખ્યા ધારે તે
૯. **સાંકેતિક :** અંગુઠો આદી ચિહ્ન વડે ફરી પરચક્ખાણ પારવાનું ધારે તે. તે આઠ બેદે છે.
૧૦. **અઢા :** કાળના પરિમાણવાળું પરચક્ખાણ. તે નવકારશી વગેરે દશ બેદે છે.

સાંકેતિક પરચક્ખાણના આઠ બેદ આ પ્રમાણે છે.

૧. **અંગુઠ સહિત :** મુઠીમાં અંગુઠો રાખું ત્યાં સુધી.
૨. **મુઢી સહિત :** મુઢી વાળી રાખું ત્યાં સુધી.
૩. **ગંઠ સહિત :** ગાંઠ બાંધી ત્યાં સુધી.
૪. **ઘર સહિત :** ઘરે જાઉં ત્યાં સુધી.
૫. **પ્રસ્વેદ સહિત :** શરીરે પરસેવાના બિંદુ નીકળે ત્યાં સુધી.
૬. **ઉસ્સાસહિત :** શાસોશાસ લાઉં અથવા જીવું ત્યાં સુધી.
૭. **થિલુક સહિત :** વાસણે ચોટેલા પાણીના બિંદુ સુકાય ત્યાં સુધી.
૮. **જોઈક્ખ સહિત :** દીવા વગેરેની જ્યોતિ રહે ત્યાં સુધી.

પરચક્ખાણ પુરું થયું હોય અને ભોજન સામગ્રી તૈયાર ન હોય અથવાતો કાર્ય પ્રસંગ જમવાને વાર હોય ત્યારે ઉપરના આઠમાંથી કોઈપણ પરચક્ખાણ કરી શકાય છે.

આહાર ચાર પ્રકારે છે.

૧. **અશન :** તરત જ ભૂખ શમાવે તે. દા.ત. રોટલી, રોટલા, પુડલા, ભાત, શાક, મગા, દૂધ, દહિંથરા વગેરે પકવાશ, સૂરણા, પ્રમુખ કંદ વિગેરે ફળ, ફુલ, શાક વગેરે જાણવા.
૨. **પાન :** પીવા ચોગય પદાર્થ દા.ત. પાણી, છાશ, કેરડા, જવ, કાકડી વગેરેના ધોયણા, મદિરા, શરબત વગેરે.
૩. **ખાદિમ :** શેકેલા ધાન્ય, કળ, મેવા વિગેરે જેનાથી થોડી તૃષ્ણિ થાય તે.
૪. **સ્થાદિમ :** સ્વાદ માટે જે ખવાય તે. દા.ત. મુખવાસ, તજ, લવિંગ, એલચી, સુંદ, જીરું અજમો, ચૂરણ વગેરે.

આગાર એટલે છૂટ. કોઈપણ પરચક્ખાણ લેતી વખતે સાથે આગાર લેવામાં આવે છે. જેથી કરીને આપણા પરચક્ખાણનો ભંગ ન થાય. તે આગારો ના નામ અને વર્ણન નીચે પ્રમાણે છે.

અનાભોગ : એટલે વિસ્મરણ (ભૂલી જવું), કાર્યમાં વ્યસ્ત હોવાથી અથવાતો ભૂલમાં કોઈ પદાર્થ મોટામાં મુકાઈ જાય તો પરચક્ખાણનો ભંગ ન થાય માટે આ આગાર બોલવામાં આવે છે.

સહસાગારેણ : એટલે પરચક્ખાણ હોવા છતાં વરસાદના છાંટા મોટામાં આવી જાય અથાવ દછી મથતાં ટીપું મોટામાં પડી જાય તો ભંગ ન થાય.

મહિતરાગારેણ : મોટી નિર્જરાના કારણભૂત સંઘ વગેરેના કાર્યને માટે વડીલની આજ્ઞાથી પરચક્ખાણ કાળ પહેલા પારે તો ભંગ થાય નહિં.

સંવસમાહિવતિયાગારેણ : તીવ્ર રોગ, દુઃખાવો વિગેરેના કારણે શરીરની સ્વસ્થતા માટે આ૱ખધ વિગેરેના કારણે પરચક્ખાણનો કાળ પૂર્ણ થયા પહેલા કાંઈ પદાર્થ લે તો ભંગ થાય નહિં.

પચ્છક્ષકાલેન : વરસાદ, ધૂળના ગોટા વિગેરેના કારણે સૂર્ય ટંકાઈ જાય અને કાળની ગણતરી ન રહે અને પરચક્ખાણ થઈ ગયું છે એમ સમજુ પારી લે તો ભંગ ન થાય.

પરંતુ પાછળથી ખબર પડે તો મોટામાં હોય તે રાખમાં પરડાવવું અને હાથમાં હોય તે વાસણમાં પાછું મુકી દેવું પછી વખત થયે જમવું. દરેક આગારમાં આ વાત સમજુ લેવી.

દિસામોઢેણ : પૂર્વ દિશાને પદ્ધિમ દિશા માની લે અને વખત થયો છે એમ સમજુને પરચક્ખાણ પારી લે તો ભંગ ન થાય.

સાહુવયણેણ : એટલે ઉગધાડા પોરિસિ એ પ્રકારનું સાધુનું વચન સાંભળીને પોરિસિ થઈ ગઈ એમ સમજુ પારી લેતો ભંગ થાય નહિં.

લેવાલેવેણ : દી વગેરે જે વિગાઈનો સાધુ ભગવંત ને નિયમ હોય તે વિગાઈવાળો ચમચો કે હાથ લુંછીને તેનાથી બીજુ વસ્તુ વહોરાવેતો પરચક્ખાણ ભંગ થાય નહિં (આ આગાર સાધુ ભગવંત માટે છે)

ત્રિહૃત્ય-સંસદ્દેણ : રોટલી, રોટલા, શાક વગેરેને દી લગાડેલ હોય તેમ છતાં નીવિ કે વિગાઈના પરચક્ખાણમાં લેવામાં આવે તો મુનિને પરચક્ખાણનો ભંગ થાય નહિં.

ઉક્તિ વિવેગેણ : રોટલી, રોટલા વગેરે ઉપર ગોળ વગેરે વિગાઈ મુકેલી હોય પછી તે લઈ લેવામાં આવે છતાં તેનો કંઈક અંશ ચોંટી રહેલ હોય તેવા રોટલા વગેરે લેવામાં આવે તો મુનિને પરચક્ખાણનો ભંગ થાય નહિં.

પડુચ્યમકિઅઅણેણ : રોટલી, રોટલા વગેરેને કુણા રાખવા માટે કરતી વખતે તેલ કે દીની આંગાળીથી ચોપડીને કરે તેમાં કંઈક વિગાઈઓ ભાગ આવ્યા છતાં મુનિને પરચક્ખાણનો ભંગ થાય નહિં.

પારિદ્ધ્રાવણિયાગારેણ : જે આહાર વાપરતા વધી પડે તે પરઠવતા દોષ-લાગતો હોય તો ગુણની આજ્ઞાથી પરચક્ખાણ હોવા છતાં વાપરે તો ભંગ થાય નહિં.

અમુક આગારો ફક્ત સાધુ ભગવંત માટે છે પરંતુ પાઠ સંલગ્ન હોવાથી શ્રાવકમાં પણ બોલાય છે.

સાગારિયાગારેણ : ગૃહસ્થની હાજરીમાં મુનિને આહાર પાણીની મનાઈ છે. કોઈ ગૃહસ્થ આહાર કરતી વખતે આવ્યો હોય અને તે સ્થિર રહેવાનો હોય તો સાધુ ભગવંત અન્યાન્ય જઈ આહાર કરે તો ભંગ થતો નથી. તેજ રીતે ગૃહસ્થને જમતી વખતે અર્દીના, સર્પ વગેરેનો ઉપદ્રવ હોય તો અન્યાન્ય જઈ ભોજન કરે તો પરચક્ખાણ ભંગ થાય નહિં.

આઉંટણપસારેણ : જમવા બેઠા, પછી ખાલી ચઠી જવાના કે એવા કોઈ કારણે હાથ-પગ આદિ અંગોપાંગ સંકોચયવા કે પ્રસારવા પડે તેથી આસન જરા ચલાયમાન થાય તો પરચક્ખાણનો ભંગ થતો નથી.

ગુરુઅભૂત્વેણ : એકાસણાંદિ તપ કરતાં ગુરુ મહારાજ આવે તો વિનય સાચવવા ઉભા થવું જોઈએ તે સાચવે તો પદ્ધ્યક્ખાણ બંગ થાય નહિં.

પાણસ : હવે પાણી સંબંધી છ આચાર બનાવે છે.

લેવેણવા: અદ્યાત્મા, અંબલી, દ્રાક્ષ વગેરેના પાણી, તે લેપકૃત કહેવાય અહિં વા શબ્દથી દરેકમાં એક થી એક પડિયાતા પણું બતાડે છે. એટલે કે લેપકૃત કરતાં અલેપકૃત ચર્ચા. તેના કરતાં ત્રણ ઉભરાઓ ઉકાળેલું પાણી વધુ ચર્ચા. આ રીતે સમજવું.

અલેવેણવા: અલેપકૃત પાણી તે લેપ વગરનું કંજુ વિગેરેનું ધોવાણ કે છાશની આશ વિગેરે.

અચ્છેણવા: અભ્ય એટલે નિર્મળ જળ. તે ત્રણ ઉકાળાથી ઉકાળેલું ઉષ્ણ જળ અથવા ફળ આદિનું ધોપણ જાણવું.

બહુલેવેણવા: બહુ લેપ એટલે ચોખા પ્રમુખનું ધોપણ.

સસ્તિથેણવા : આટાથી ખરડાયેલ હાથ કે વાસણનું ધોપણ જેમાં આટાના રજકણો પણ આવી જાય છે.

અસ્તિથેણવા: આટાથી ખરડાયેલ હાથ અથવા વાસણનું ધોયણ જેમાં આટાના રજકણ આવે નહિં એવું ગાળું ધોપણનું પાણી.

પદ્ધ્યક્ખાણ

મૂળ ગુણરૂપ

દેશથી	સર્વેથી
(અમુક પ્રમાણમાં નિમયરૂપ)	(સંપૂર્ણ નિયમરૂપ)
પાંચ અણુવ્રત	પાંચ મહાવ્રત
(શ્રાવકો માટે)	(સાધુ ભગવંતો માટે)
૧. અહિંસા	૧. સંપૂર્ણ અહિંસા પાલન
૨. અસત્ય ન બોલવું	૨. સંપૂર્ણ અસત્યવચન ત્યાગ
૩. ચોરી ન કરવી	૩. સંપૂર્ણ ચોરી ત્યાગ
૪. બ્રહ્મચર્ય પાળવું	૪. સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન
૫. પરિગ્રહનો નિયમ	૫. પરિગ્રહ ત્યાગ

ઉત્તર ગુણરૂપ

દેશથી	સર્વેથી
૧. અનાગત	૧. પિંડ વિશુદ્ધિ
૨. અતિકાન્ત	૨. પાંચ સમિતિ
૩. કોટિ સહિત	૩. બાર ભાવના
૪. નિયંત્રિત	૪. બાર પ્રકારનો તપ
૫. આનાચાર	૫. બાર પ્રતિમા
૬. સાગાર	૬. અભિગ્રહ
૭. નિરવશેષ	૭. (ફક્ત સાધુ ભગવંતો માટે)
૮. પરિમાણકૃત	
૯. સાંકેતિક	
૧૦. અદ્રા.	

નમુકારસાહિઅ

પોરિસિ

સાઠ પોરસિંહિ

પુરિમહુ

અવહુ

અકાસણું

બિયાસણું

આચારિલ

તિવિહાર ઉપવાસ

ચોવિહાર ઉપવાસ

અંગુષ્ઠસાહિઅ

મુહુસાહિઅ

ગંઢ સહિઅ

ઘર સહિઅ

પ્રસ્વેદ સહિઅ

ઉસ્સા સહિઅ

થિબુક સહિઅ

જોઈક્ખ સહિઅ

પદ્ધતિકાળાણ કરનારે ધ્યાનમાં રાખવા જેવી વિગતો

- ૧ કોઈપણ પદ્ધતિકાળાણ સૂર્યોદય થતાં પહેલાં ઉત્કૃષ્ટ ફળ મળે છે.
- ૨ કોઈપણ પદ્ધતિકાળાણ પારતી વખતે બેસીને પલાઠીવાળી મુઢીવાળીને અણા નવકાર ગણવા.
- ૩ નવકારશી સૂર્યોદય પછી ૪૮ મિનિટે, પોરિસિ - લગાભગ અણા કલાકે સાટ પોરિસિ લગાભગ સાડા ચાર કલાકે, પુરિસુરુ - લગાભગ છ કલાકે, અવરુ - લગાભગ નવ (૬) કલાકે પદ્ધતિકાળાણ પારી શકાય.
- ૪ એકાસણું, બિયાસણું, આયંબિલ વિગેરે તપમાં જમતાં પહેલાં પાટલો સ્થિર રાખવો. ત્યારબાદ જમી લઈએ ત્યાં સુધી પાટલો હલવો ન જોઈએ.
- ૫ તપશ્ચયાર્માં અભક્ષય, અનંતકાય ખવાય નહિં (દા.ત. ચોકલેટ, આઈસ્ક્રીમ, બરફ, ઠંડા પીણા, બહારની મિઠાઈઓ)
- ૬ એકાસણું, બિયાસણું, આયંબિલ વગેરે તપમાં જમી લીધા બાદ તિવિહાર નું પદ્ધતિકાળાણ કરવું.
(બિયાસણામાં બીજુ વખત જમી લીધા બાદ તિવિહાર કરવો.)
- ૭ સાંજે સૂર્યાસ્ત પહેલા પાણહારનું પદ્ધતિકાળાણ કરવું.
- ૮ એકાસણું, આયંબિલમાં ઠામ ચોવિહાર કરવો હોય તેમણે જમી લીધા બાદ- ચોવિહાર નું પદ્ધતિકાળાણ કરવું (સાંથે પદ્ધતિકાળાણ લેવું જરૂરી નથી)
- ૯ દરેક તપશ્ચયાર્માં અણા ઉકાળાવાળું પાણી વાપરવું.

પદ્ધતિકાળાણ કરવાથી પ્રાપ્ત થતું ફળ

- ૧ સવારમાં નવકારશી અને સાંજના ચોવિહારનું પદ્ધતિકાળાણ કરનાર જુવ તિર્યંચ કે નરક ગતિમાં જતો નથી.
- ૨ ધર્મની ભાવના વિના જે દુઃખો સહન કરવામાં આવે છે અને તેનાથી જે કર્મો દ્વારા થાય છે તેને અકામ નિર્જરા કહેવાય.
- ૩ નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરા વડે ભયંકર દુઃખોને સહન કરવાથી સો વર્ષમાં જેટલાં ખપાવે તેટલા જ કર્મો માત્ર નવકારશીનું પદ્ધતિકાળાણ કરનારો ખપાવી શકે છે.
- ૪ પોરસીનું પદ્ધતિકાળાણ કરનાર એક હજાર વર્ષોના કર્મો ખપાવી શકે છે.
- ૫ સાટ પોરસીનું પદ્ધતિકાળાણ કરનાર દસ હજાર વર્ષોના કર્મો ખપાવી શકે છે.
- ૬ પુરિમુઠનું પદ્ધતિકાળાણ કરનાર એક લાખ વર્ષના કર્મો ખપાવી શકે છે.
- ૭ એકાસણાનું પદ્ધતિકાળાણ કરનાર દસ લાખ વર્ષના કર્મો ખપાવી શકે છે.
- ૮ નીવિનું પદ્ધતિકાળાણ કરનાર એક કોડ વર્ષના કર્મો ખપાવી શકે છે.
- ૯ એકલઠાણાનું પદ્ધતિકાળાણ કરનાર દસ કોડ વર્ષના કર્મો ખપાવી શકે છે.
- ૧૦ એકલદટાનું પદ્ધતિકાળાણ કરનાર સો કોડ વર્ષના કર્મો ખપાવે છે.
- ૧૧ આયંબિલનું પદ્ધતિકાળાણ કરનાર એક હજાર કોડ વર્ષના કર્મો ખપાવે છે.
- ૧૨ ઉપવાસનું પદ્ધતિકાળાણ કરનાર દસ હજાર કોડ વર્ષના કર્મો ખપાવે છે.
- ૧૩ છજુનું પદ્ધતિકાળાણ કરનાર એક લાખ કોડ વર્ષના કર્મો ખપાવે છે.
- ૧૪ અષ્ટુંનું પદ્ધતિકાળાણ કરનાર દસ લાખ કોડ કોડના કર્મો ખપાવે છે.
- આ પ્રમાણે એક એક ઉપવાસની વૃદ્ધિએ દસ ગુણા વર્ષો વધારતા જવું એટલા નરકના ઘોર દુઃખો કપાય.

પદ્યકખાણા (પ્રતિફા) સાચુ કયારે કહેવાય?

- ૧ શ્રદ્ધા : કેવળી ભગવંતે ઉપદેશોલાં સર્વે પદ્યકખાણા મોક્ષમાર્ગનાં સાધનભૂત છે એવી દંડ શ્રદ્ધા એ દર્શનશુદ્ધિ છે.
- ૨ જ્ઞાન : પદ્યકખાણા વિષયક સર્વ બાબતોના જાણકાર થવું. જેણે પદ્યકખાણા કરવું હોય તેને, પોતે જ પદ્યકખાણા કરે છે તેનું જ્ઞાન હોવું જોઈએ. પદ્યકખાણાનું સ્વરૂપ, તેના પાઠોનો ભાવાર્થ, તેના આગારો, તેનું ફળ તેમાં કઈ વસ્તુ કલ્પે, કઈ વસ્તુ ન કલ્પે વગેરેની સમજણ તે જ્ઞાનશુદ્ધિ છે.
- ૩ વિનય : ગુરુવંદન કરવાથી વિનય થાય છે. ગુરુના વિનય-બહુમાનપૂર્વક જ પદ્યકખાણા આરાધવું. ગુરુને વિધિપૂર્વક વંદન કરીને પદ્યકખાણા લેવું તે વિનયશુદ્ધિ છે.
- ૪ અનુભાષણ : પદ્યકખાણા લેતી વખતે ઉપયોગ રાખી ગુરુમહારાજ ‘પદ્યકખાઈ’ બોલે ત્યાં ‘પદ્યકખામિ’ અને ‘વોસિરઈ’ બોલે ત્યાં ‘વોસિરામિ’ બોલવું તે અનુભાષણશુદ્ધિ છે.
- ૫ અનુપાલન : સંકટ સમયે પણ પદ્યકખાણા ભાંગયા વિના સંપૂર્ણ સાવધાનીયી પાળવું. અટવીમાં, દુષ્કાળમાં કે મહારોગ ઉત્પણે થવા છતાં, પદ્યકખાણા ભાંગયા વિના બરાબર પાળવું તે પાલના શુદ્ધિ છે.
- ૬ ભાવ : માયાશાલ્ય, મિથ્યાત્વશાલ્ય, નિયાણશાલ્ય રાખ્યા વિના સકામ નિર્જરા થાય તેમ ખરા ભાવથી પદ્યકખાણા પૂર્ણ કરવા તત્પર રહેવું તે ભાવશુદ્ધિ છે.
પદ્યકખાણાની આ છ શુદ્ધિ છે, તે જાળવવાથી પદ્યકખાણાનું વાસ્તવિક ફળ પામી શકાય છે.
- ૭ કોઈપણ પદ્યકખાણા આપણો આત્મા તેમ જ દેવ અને ગુરુ આ પ્રણેની સાક્ષીએ કરવું જોઈએ.
આત્મસાક્ષી : સવારમાં સૂર્યોદય પહેલાં ઊઠીને તરત જ પોતાની જાતે પદ્યકખાણા લઈએ અથવા ધારીએ તો આત્મસાક્ષીએ પદ્યકખાણા કર્યું કહેવાય.
- ગુરુસાક્ષી : દેરાસરમાં કે અન્યાન્ય પ્રભુજી સમક્ષા ‘ઈચ્છકારી ભગવનું પસાય કરી પદ્યકખાણાનો આદેશ દેશોજુ’ એમ બોલીને ગુરુમહારાજના મુખેથી, વડીલ શ્રાવકના મુખેથી આપણી જાતે પદ્યકખાણા લઈએ અથવા ધારીએ તે દેવ એટલે ભગવાનની સાક્ષીએ પદ્યકખાણા કર્યું કહેવાય.
- ૮ પોતાની જાતે કે ગુરુ પાસે પદ્યકખાણા કરતી વખતે પદ્યકખાણામાં ઉપયોગ હોવો જોઈએ. ઉપયોગ વિના કરેલું પદ્યકખાણા દ્વાર્ય પદ્યકખાણા બને.
- ૯ સવારનાં પદ્યકખાણા આત્મસાક્ષીએ સૂર્યોદય પહેલાં લઇ લેવાં જોઈએ. પદ્યકખાણાનો પાઠ ન આવડતો હોય તો ‘મારે આજે આમુક પદ્યકખાણા છે’ એમ મનમાં ધારણા કરી લેવી જોઈએ. પદ્યકખાણા ધારીએ તે પણ પદ્યકખાણા લીધા બરાબર જ છે, પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકે નથી.
- ૧૦ પદ્યકખાણામાં ‘ઉંગાએ સ્ફૂર્તે’ અને ‘સ્ફૂર્તે ઉંગાએ’ આમ બે પ્રકારના પાઠ આવે છે.
- ૧૧ જે પદ્યકખાણામાં ‘ઉંગાએ સ્ફૂર્તે’ પાઠ આવે છે તે પદ્યકખાણા સૂર્યોદય પહેલાં લેવાથી કે ધારવાથી જ શુદ્ધ ગણાય છે.
- ૧૨ પદ્યકખાણા લેવામાં લેનારનો ઉપયોગ અથર્ત ધારેલું પદ્યકખાણા જ પ્રમાણ છે, પણ પદ્યકખાણાનો પાઠ બોલવામાં થતી અક્ષરની ભૂલ પ્રમાણ નથી. અક્ષરની ભૂલ થઈ હોય એટલે કે ચાઉચિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં ચાઉચિહારને બદલે તિવિહાર બોલાઈ જાય અથવા તિવિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં ચાઉચિહાર બોલાઈ જાય, એગાસણને બદલે બિયાસણ અને બિયાસણને બદલે એગાસણ પાઠ ભૂલથી બોલાઈ જાય-આમ ફેરફારવાળો પાઠ બોલવા છતાં પણ પદ્યકખાણા તો લેનારે જે ધાર્યું હોય તે જ પ્રમાણ ગણાય છે.
- ૧૩ આપણે જે પદ્યકખાણા કરવું હોય તે પદ્યકખાણાનો લાભ આપણાને પૂરેપૂરો મળે તે માટે પદ્યકખાણા સૂર્યોદય પહેલાં જ લઇ લેવું જોઈએ અથવા ધારી લેવું જોઈએ.

- ૧૪ નવકારશીનું પદ્યકખાણા નવકાર બોલીને પારવામાં આવે છે, માટે એ નવકારશીનું પદ્યકખાણા કહેવાય છે.
- ૧૫ નવકારશીનું પદ્યકખાણા કરનાર નવકાર ગણ્યા વિના ભોજન કરે તો તેના પદ્યકખાણાનો ભંગ થાય છે, કેમ કે પદ્યકખાણાના પાઠમાં નવકાર ગણવાનું સ્વીકારેલું છે. ('શ્રાદ્ધવિધિ')
- ૧૬ નવકારશીનું પદ્યકખાણા સૂર્યોદય પહેલાં ધારી લેવું જોઈએ, તો જ તે શુદ્ધ ગણાય. સૂર્યોદય પછી ધાર્યું હોય તો શુદ્ધ ગણાય નહિં. તેનો લાભ ઘટે, યથાર્થ ફળ મળે નહિં.
- ૧૭ વર્તમાન કાળે ૧૬ ઉપવાસથી એક સાથે મોટું પદ્યકખાણા આપવાની સામાચારી નથી. નવકારશીથી માંડીને ૧૬ ઉપવાસ સુધીનાં પદ્યકખાણામાંથી પોતાને જે પદ્યકખાણા કરવું હોય તે નક્કી કરીને 'મારે આજે અમૃક પદ્યકખાણા છે' એમ પોતાની જાતે પ્રગટપણે કે મનમાં બોલવું તેને પદ્યકખાણા ધાર્યું કહેવાય.
- ૧૮ જે પદ્યકખાણા ધરાય તે પદ્યકખાણા લીધા બરાબર જ હોવાથી, દેવ-ગુરુની સાક્ષીઓ લેતી વખતે તે જ પદ્યકખાણા લેવું અર્થાત્ તેનાથી અધિક લેવું, પણ ઓછું લેવું નહિં.
- ૧૯ જેમ પદ્યકખાણાનો પાઠ બોલીને લીધેલા પદ્યકખાણાને તેનાથી નાના પદ્યકખાણામાં ફેરવી શકાતું નથી તેમ ધારેલા પદ્યકખાણાને પણ તેનાથી નાના પદ્યકખાણામાં ફેરવી શકાતું નથી.
- ૨૦ તિવિહાર ઉપવાસ, આયંબિલ, એકાસણું કે બિયાસણાનું પદ્યકખાણા ધારતી વખતે તેની સાથે પોરિસી, સાહુપોરિસી, પુરિમુહૂ વગેરે પદ્યકખાણામાંથી પોરિસી વગેરે જે પદ્યકખાણા કરવું હોય તે પણ ધારવું જોઈએ.
- ૨૧ સાહુપોરિસી આદિનાં પદ્યકખાણા તે તે પદ્યકખાણાના સમયે થોડી વાર હોય ત્યારે પણ લઈ શકાય છે, અથવા ધારી શકાય છે.
- ૨૨ પરંતુ આમાં એટલું સમજુ લેવાનું કે નવકારશીનું પદ્યકખાણા સૂર્યોદય પૂર્વ ધારવાને બદલે સૂર્યોદય પછી ધાર્યું હોય તો તેમાં આગળ વધીને કરેલાં બધાં પદ્યકખાણા અશુદ્ધ ગણાય છે.
- ૨૩ ઉપાશ્રયે જઈ આસન ઉપર બિરાજમાન ગુરુમહારાજને વિધિપૂર્વક વંદન કરી 'ઈચ્છકારી ભગવનું પસાચ કરી પદ્યકખાણાનો આદેશ દેશોજુ' એમ બોલીને આપણે પદ્યકખાણા લઈએ તો ગુરુમહારાજનો વિનય કરીને વિવેકપૂર્વક પદ્યકખાણા લીધું કહેવાય.
- ૨૪ ગુરુમહારાજ પદ્યકખાણાનો પાઠ બોલે તો ઉપયોગપૂર્વક સાંભળવો જોઈએ આપણે આવકટું હોય તે પદ્યકખાણા સાથે સાથે મનમાં બોલતાં રહેવું જોઈએ. ગુરુમહારાજ જ્યાં 'પદ્યકખાઈ' બોલે ત્યાં 'પદ્યકખામિ' અને 'વોસિરઈ' બોલે ત્યાં 'વોસિરામિ' બોલવું જોઈએ.
- ૨૫ પૌષ્યધમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ કે એકાસણું કરનારે ઓછામાં ઓછું પુરિમુહૂનું પદ્યકખાણા કરવું જોઈએ એવી મર્યાદા છે.
- ૨૬ દેરાસરમાં ગુરુમહારાજ સ્તુતિ કે ચૈત્યવંદન કરતા હોય ત્યારે તેમની પાસે પદ્યકખાણા મગાય નહિં. તેવા વખતે પદ્યકખાણા માગવાથી તેમને પ્રભુભક્તિમાં વિક્ષેપ થાય છે. તેથી પ્રભુભક્તિ વિક્ષેપ ન પડે તેવી રીતે વિવેદપૂર્વક તેમી પાસે પદ્યકખાણા લેવું જોઈએ.
- ૨૭ દેરાસરની બહાર રસ્તા ઉપર, ઉપાશ્રયની બહાર રસ્તા ઉપર, ઉપાશ્રયમાં આવવા-જવાના રસ્તામાં, ઉપાશ્રયના દાદરમાં, આયંબિલખાતા વગેરેમાં કે આપણા ઘેર ગોચરી-પાણી વહોરવા પદ્યાર્થ હોય ત્યાં અને બજાર વચ્ચે ગુરુમહારાજને રોકીને, ઊભા રાખીને, અવિદ્યાથી તેમ જ અવિનય અને અવિવેકપૂર્વક તેમની પાસે કદી પણ પદ્યકખાણા મયાગ નહિં. એવી રીતે પદ્યકખાણા માગવાથી દેવ-ગુરુ-ધર્મની આશાતના થાય છે. અને અમના પ્રત્યે આપણા હૃદયમાં બહુમાનભાવ પણ ઘટે છે.

- ૨૮ ખાસ કારણાસર ગુરુમહારાજ પાસે દેર બેઠાં પચ્યકખાણ લેવું પડે તેમ હોય ત્યારે પણ આમ વિનય-વિવેક સહિત બહુમાનપૂર્વક જ પચ્યકખાણ લેવાય, પણ ગુરુમહારાજની અનુકૂળતા જાણ્યા વિના તેમને રોકીને, ઊભા રાખીને, વંદન કર્યા વિના અને તેમને પચ્યકખાણ આપવાની ફરજ પડે તેવું કરીને વિનય-બહુમાનરહિતપણે, અવિવેકપૂર્વક તો કદી પણ પચ્યકખાણ લેવાય નહિ. એવી રીતે પચ્યકખાણ લેવાથી તેમની આશાતના થાય અને પચ્યકખાણ ચોગ્ય રીતે ફળે નહિ.
- ૨૯ પચ્યકખાણનો પાઠ મોટે ન આવડતો હોય તો ચોપડીમાં જોઈને પોતાની જતે બોલી લેવો જોઈએ. તે પણ ન બની શકે તેમ હોય તો ‘મારે અમૃક પચ્યકખાણ છે’ એમ બોલીને જે પચ્યકખાણ કરવાનું હોય તે મનમાં ધારી લેવું જોઈએ. પચ્યકખાણ ધારવામાં આવે તે પચ્યકખાણ લીધા બરાબર છે. પણ પુરુષોએ સાધવીજી મહારાજ પાસે કે માતા, બહેન વગેરે કોઈપણ જી પાસે પચ્યકખાણ લેવાય નહિ.
- ૩૦ નવકારશી, પોર્ટિસી વગેરે પચ્યકખાણ આપણા ગામના સ્થાનિક સ્થૂર્યોદય પ્રમાણે કેટલા વાગ્યે આવે તે ચોક્કસપણે જાણી લેવું જોઈએ. આપણી ઘડિયાળ પણ ચોક્કસપણે સ્થૂર્યોદય સાથે મેળવેલી હોવી જોઈએ. નવકારશી આદિનાં પચ્યકખાણ તેનો સમય થયા પહેલાં પરાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. પચ્યકખાણ સ્થિર આસને બેસીને જ પારવું જોઈએ.
- ૩૧ આયંબિલ, એકાસણું અને બીજું બિયાસણું કરી લીધા પછી મુખશુદ્ધિ કરીને તિવિહારનું પચ્યકખાણ કરવું જોઈએ. પચ્યકખાણનો પાઠ ન આવડતો હોય તો ‘મારે તિવિહારનું પચ્યકખાણ છે’ એમ બોલીને ધારી લેવું જોઈએ. પછી ગુરુમહારાજ પાસે જઈને વંદન કરીને લઇ લેવું જોઈએ અને સાંજે સ્થૂર્યાસ્ત પહેલાં પાણી ચૂકવ્યા પછી તરત જ પાણાહારનું પચ્યકખાણ કરી લેવું જોઈએ અથવા ધારી લેવું જોઈએ.
- ૩૨ સવારનાં બધાં પચ્યકખાણ દાતણ કર્યા વિના, ખાદ્યાં-પીધ્યાં પહેલાં જ લેવાય. દાતણ કર્યા પછી, પાણી પીધ્યા પછી કે આયંબિલ, એકાસણું કરી લીધા પછી નવકારશી કે આયંબિલ, એકાસણું આદિનું પચ્યકખાણ લેવાય નહિ.
- ૩૩ છઠું-અહુમ આદિનાં મોટાં પચ્યકખાણ કરનારે તે પચ્યકખાણ ચાલુ હોય ત્યાં સુધી બીજા દિવસની રોજ પોર્ટિસી, સાહુપોર્ટિસી આદિ સહિત પાણાહારનું પચ્યકખાણ લેવું જોઈએ.
- ૩૪ પર્યુક્તાણ જેવા મહાપર્વના દિવસોમાં તો ગુરુમહારાજને શ્રમ ન પડે, તેમનું ગાળું બેસી ન જાય તે માટે સૌંદર્ય સમૂહમાં જ પચ્યકખાણ લેવાં જોઈએ. દરેક છૂટાંછૂટાં લેવાં ચોગ્ય નથી.
- ૩૫ મૂઢસી (મુહુસાહિઅં) પચ્યકખાણ શ્રાવક માટે બહુ ઉપયોગી અને ધાણું ફળ આપનાલું છે. મુખશુદ્ધિ કરી મૂઢસીનું પચ્યકખાણ લેવું. પછી જયારે પણ કાંઈ ખાવું-પીવું હોય ત્યારે સ્થિર આસને બેસી, મૂઢી વાળી, નવકાર ગાણી પચ્યકખાણ પારી ખાઈ-પી શકાય. ખાઈ-પી લીધા પછી મુખશુદ્ધિ કરીને ફરીથી મૂઢસીનું પચ્યકખાણ લેવું.
- ૩૬ આ પચ્યકખાણ ખાવાપીવાના સમય સિવાય આખો દિવસ પચ્યકખાણમાં અર્થાત વિરતિમાં રહેવાય છે. વિરતિનો લાભ બહુ મોટો છે. દરરોજ એકવાર ભોજન કરનારને દર માસે ર૨૮ ચાઉવિહાર ઉપવાસનો અને બે વાર ભોજન કરનારને ર૨૮ ચાઉવિહાર ઉપવાસનો લાભ મળે છે.
- ૩૭ પચ્યકખાણ લઇને તે પાળવાની ભાવનાવાળાના પચ્યકખાણનો અજાણતાં નંગા થઈ જાય તો તેને પ્રાયશ્ચિત ઓછું આવે છે, પણ તૂટી જવાના ભયથી પચ્યકખાણ નહિ કરનારને પ્રાયશ્ચિત મોટું આવે છે, માટે તૂટી જવાનો ભય રાખ્યા વિના પાળવાની દટ ભાવના રાખીને યથાશક્તિ પચ્યકખાણ અવશ્ય કરવું જોઈએ.
- ૩૮ આપણી મરજી મુજબ નહિ પણ, દેવ, ગુરુ, ધર્મની જરા પણ આશાતના ન થાય, વંદન આદિ દ્વારા તેમનો પૂર્વેપૂર્વો વિનય સચ્યવાય તેમ વિવેકપૂર્વક વિધિસહિત પચ્યકખાણ લેવું જોઈએ.
- ૩૯ ચાઉવિહાર ઉપવાસ કરનારે સાંજે મોડામાં મોડું સ્થૂર્યાસ્ત સુધીમાં ફરીથી ચાઉવિહાર ઉપવાસનું (સ્થૂરે ઉગાએ) પચ્યકખાણ કરવું. સાંજે ફરીવાર આ પચ્યકખાણ કરવાથી ચારેય પ્રકારનો આહાર જ દિવસે બંધ હતો તે ચારે પણ બંધ છે એની તેમ જ સવારે લીધેલા પચ્યકખાણની પોતાને પુનઃસ્મૃતિ થાય છે.

- ૪૦ પાણાહાર :** ઉપવાસ કર્યું હોય અને તેમાં પાણી પીધું હોય તેણે તિવિહાર ઉપવાસ કહેવાય છે. તિવિહાર ઉપવાસમાં પાન એટલે પાણી સિવાયના અશાન, ખાદિમ અને સ્વાદિમ એ ગ્રાણ પ્રકારના આહારનો ત્યાગ થાય છે.
- ૪૧** જેણે તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું કે બિયાસણું કર્યું હોય તેણે સાંજે સૂર્યાસ્ત પહેલાં પાણી ચૂકવીને પાણાહારનું પરચ્યકખાણ કરવું.
- ૪૨** પાણાહાર એટલે પાણીના ત્યાગનું પરચ્યકખાણ. આ પરચ્યકખાણ કરવામાં આવે ત્યારથી માંડીને પાણીસ્વરૂપ આહાર કે જે, દિવસ માટે ખુલ્લો હતો તે રાત્રિ પર્યત (રાત્રિ હોય ત્યાં સુધી અર્થાતું બીજા દિવસના સૂર્યોદય પહેલાંના સમય સુધી) બંધ થાય છે.
- ૪૩ ચઉંબિહાર :** જેણે આયંબિલ, નીવિ કે એકાસણું ઠામ ચઉંબિહાર કર્યું હોય તેણે તે કરી લીધા પછી મુખશુદ્ધિ કરીને તે વખતે અને સાંજે પણ સૂર્યાસ્તને થોડી વાર હોય ત્યાં સુધીમાં ચઉંબિહારનું પરચ્યકખાણ કરવું.
- ૪૪ ખાસનોંધ :** પાણાહાર અને ચઉંબિહારનું પરચ્યકખાણ પ્રતિકમણ કરતાં પહેલાં કરાય છે. આ પરચ્યકખાણ કરાય છે. આ પરચ્યકખાણ કરાય છે ત્યારથી રાત્રિપર્યત પાણીનો સર્વથા ત્યાગ થતો હોવાથી સંવત્સરી જેવા દિવસે સૂર્યાસ્ત પહેલાં પ્રતિકમણ પૂર્ણ થઈ ગયું હોય અર્થાતું પ્રતિકમણ પૂર્ણ થઈ ગયા પછી દિવસ હોય તોપણ પાણી પિવાય નહિં. અજ્ઞાનને કારણે ગડબડ થવાનો સંભવ હોવાથી આ મહિનાની વાત અવશ્ય દ્યાનમાં રાખવા યોગ્ય છે. સાંજનું પ્રતિકમણ કર્યા પછી માત્ર તિવિહાર અને દુવિહારના પરચ્યકખાણવાળા જ પાણી પી શકે, તે સિવાયના પરચ્યકખાણવાળા પાણી પી શકે નહિં.
- ૪૫ તિવિહાર :** જેણે આયંબિલ, નીવિ, એકાસણું કે બિયાસણું કર્યું હોય તેણે આયંબિલ, નીવિ, એકાસણું અને બીજું બિયાસણું કરી લીધા પછી મુખશુદ્ધિ કરીને તિવિહારનું પરચ્યકખાણ કરવું.
- ૪૬** તિવિહાર એટલે પાણી સિવાયના ગ્રાણ પ્રકારના આહારના ત્યાગનું પરચ્યકખાણ આ પરચ્યકખાણ કરવામાં આવે ત્યારથી માંડીને અશાન, ખાદિમ અને સ્વાદિમ એ ગ્રાણ પ્રકારના રાત્રિ પર્યત ત્યાગ થાય છે, માત્ર એક પાણીસ્વરસપ આહારનો ત્યાગ થતો નથી.
- ૪૭ વિશેષ નોંધ:** તિવિહારનું પરચ્યકખાણ કરતી વખતે સાથે સાથે ‘મારે અમૃક સમય’ (આશારે રાત્રિના ૬/૧૦ વાગ્યા) સુધીમાં અને અમૃક ખ્યાલા-લોટાથી વધારે પાણી પીવું નહિં.’ એવા અભિગ્રહનું પરચ્યકખાણ કરવામાં આવે અને તે અભિગ્રહનું પરચ્યકખાણ પૂર્ણ થયા પછી પણ ‘હવે બાકીની રાત્રિ દરમિયાન મારે પાણીનો સર્વથા ત્યાગ છે’ એવું (બીજુ વાર) અભિગ્રહનું પરચ્યકખાણ કરવામાં આવે તથ તે વિશેષ લાભનું કારણ બને છે.
- ૪૮** સાંજના પાણાહાર આદિ બધાં પરચ્યકખાણ (મોડામાં મોડાં) સૂર્યાસ્તને થોડી વાર હોય ત્યાં સુધીમાં લઈ લેવાં જોઈએ, અથવા ધારી લેવા જોઈએ.
- ૪૯ “ઈરછકારી ભગવનું પસાય કરી પરચ્યકખાણનો આદેશ દેશોજુ”**
- શબ્દાર્થ :** સ્વકીય ઈરછાથી હે ભગવનું ! કૃપા કરીને મારે યોગ્ય પરચ્યકખાણ કરાવશોજુ.
- ભાવાર્થ :** મારા કે બીજા કોઈના કોઈપણ જાતના દબાણ વિના આપની પોતાની જ ઈરછાથી હે ભગવનું! મારા ઉપર કૃપા કરીને પ્રસંગતાપૂર્વક (જે પરચ્યકખાણ કરવાની મારી ભાવના છે તે અથવા આપને યોગ્ય લાગો તે અર્થાતું મારે યોગ્ય હોય તે) પરચ્યકખાણ મને કરાવશોજુ.
- ૫૦ ગુરુમહારાજની સ્વકીય ઈરછાથી પ્રસંગતાપૂર્વક શિષ્ય કે શ્રાવકને જે પરચ્યકખાણ કરાવે છે, તે પરચ્યકખાણની આરાધના શિષ્ય અને શ્રાવક ગુરુકૃપાના બળે નિર્વિદ્ધને કરી શકે છે. કઠિન કર્માંની નિર્જરા કરી ભવસાગરનો પાર પામે છે. જ્યારે ગુર્વાઙ્ગાનિરપેક્ષા બનીને સ્વચ્છંદપણે માસખમણને પારણે માસખમણ જેવો ઘોર તપ કરનાર પણ કર્મનિર્જરા કરી શકતો નથી. એવો સ્વભંદી જીવ ચિરકાળ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે.**